

# ઉંચા લોહીના દબાણનો પરિચય

ઉંચું લોહીનું દબાણ યુ.કે. માં, સ્ટ્રોક, હદયનો હુમલો અને હદયરોગ મારફત થતી અશક્તતા અને કાચી ઉભરે મૃત્યુનું સૌથી મોટું જાણીતું કારણ છે. યુ.કે. માં ત્રણ પુખ્ત વ્યક્તિએ એકને ઉંચું લોહીનું દબાણ રહે છે અને દરરોજ ઉપ્તો લોકોને આ સ્થિતિને લીધે નિવારણપાત્ર સ્ટ્રોક કે હદયનો હુમલો થાય છે.

## લોહીનું દબાણ એટલે શું ?

- તમારું હદ્ય ખાકે ત્યારે, શરીરને જરૂરી ઊર્જા અને ઓડિક્સજન આપવા તે તમારા શરીર ફરતે લોહીનું પર્મિંગ કરે છે. લોહી વહે ત્યારે તે રક્તવાહિનીઓની દિવાલને ધકકો મારે છે. આ ધકકો મારવાની શક્તિ એટલે તમારા લોહીનું દબાણ છે.
- લોહીનું દબાણ કોઈ એવી વસ્તુ નથી કે જે તમે અનુભવો કે તમારા ધ્યાનમાં આવે. તમારું લોહીનું દબાણ જાણવાનો એકમાત્ર રસ્તો છે તેને માપવું તે છે.
- લોહીના દબાણને મક્કુરિ મિલિમિટરમાં મપાય છે. (mmhg), જ્યારે તમારું લોહીનું દબાણ માપવામાં આવે ત્યારે તે બે સંખ્યા તરીકે લખાશે. ઉદાહરણ તરીકે, તમારું વાંચન 120/80 હોય તો, તમારું લોહીનું દબાણ 120 ઓવર 80 છે.
- નીચેના કોઠામાં જુદા જુદા વાચનોનો કષો અર્થ થઈ શકે તે દર્શાવ્યું છે.

લોહીના દબાણ વાંચન	આનો અર્થ શું થાય	તમારે શું કરવું જરૂરી બને
120 ઓવર 80 કરતાં ઓફ્સ્ટ્રું	તમારું લોહીનું દબાણ સાધારણ અને તંદુરસ્ત છે.	તમારું લોહીનું દબાણ આ સરે જાળવી રાખવા નીરોગી જીવનશૈલી અનુસરો.
121 ઓવર 81 અને 139 ઓવર 89 ની વચ્ચે	તમારું લોહીનું દબાણ તે હોવું જોઈએ તે કરતાં સહેજ વહુ છે, અને તમારે તે નીચું લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.	તમારી જીવનશૈલીમાં આરોગ્ય વિભયક ફેરફારો કરો.
140 ઓવર 90 કે તેથી વધુ (ઘણા અઠવાડિયાઓ સુધી)	તમને ગુંચા લોહીનું દબાણ છે	તમારી જીવનશૈલી બદલો - તમારા ડોક્ટર કે નર્સને મળો અને તેઓ તમને આપે તેવી કોઈપણ દવા લો

## ગુંચા લોહીનું દબાણ એટલે શું ?

- તમારું વાંચન ઘણાં અઠવાડિયાઓ સુધી સતત -- ઓવર --, કે વહુ હોય તો તમને કદાચ ગુંચા લોહીનું દબાણ છે. તે હોવું જોઈએ તે કરતાં માત્ર એક નંબર વહુ હોય તો પણ તમારું લોહીનું દબાણ ગુંચા હોઈ શકે.
- ગુંચા લોહીના દબાણની સામાન્ય રીતે કોઈ નિશાની કે લક્ષણો હોતા નથી, તેથી તમને ગુંચા લોહીનું દબાણ હોય તો તે જાણવાનો માત્ર એક રસ્તો છે અને તે તમારું લોહીનું દબાણ માપવું તે છે. આમ છતાં એક જ ગુંચા વાચનનો અર્થ આવશ્યકપણે એવો નથી થતો કે તમને ગુંચા લોહીનું દબાણ છે. દિવસ દરમિયાન ઘણી વસ્તુઓ તમારા લોહીના દબાણને અસર કરી શકે, જેથી તમારે એ જોવું જરૂરી બનશે કે સમય જતાં તે ગુંચા રહે છે કે કેમ.

## ગુંચા લોહીનું દબાણ શાથી મહત્વપૂર્ણ છે ?

- તમારું લોહીનું દબાણ ગુંચા હોય તો તે તમારા હદ્ય અને રક્તવાહિનીઓ પર વધારાનો બોજો મૂકે છે. સમય જતાં આ વધારાનો બોજો તમારા શરીરના અંગોને નુકશાન કરી શકે, જેનાથી તમારે આરોગ્યના પ્રશ્નોનું જોખમ ઉભું થાય.
- તમને ગુંચા લોહીનું દબાણ હોય અને તમે તેના પર કાણૂન મેળવી શકો તો, તેનાથી હદ્યનો હુમલો કે સ્ટ્રોકનું જોખમ ઉભું થાય છે. ગુંચા લોહીના દબાણથી હદ્ય અને કીડિનીનો રોગ પણ થઈ શકે અને અમુક પ્રકારના ચિત્તભ્રમ સાથે પણ તેને ગાઢ સંબંધ છે.

## ઉંચું લોહીનું દબાણ ક્યા કારણે થાય છે ?

- ▶ મોટાભાગના લોકો માટે તેમના ઉંચા લોહીના દબાણનું એક જ કારણ ન હોઈ શકે. અમને ચોકક્સ ખબર નથી કે શાનાથી ઉંચું લોહીનું દબાણ થાય છે. અમે એ જાણીએ છીએ કે તમારી જીવનશૈલી તે વિકસાવવાના જોખમને અસર કરી શકે છે. તમને સૌથી વધુ જોખમ છે, જો:
- ▶ તમે પૂરતા ફળ અને શાકભાજ ન ખાવ; તમે અતિશય મીઠું ખાવ; તમે પૂરતા સક્કિય ન હોવ; તમારું વજન વધુ હોય; અથવા તમે વધુપડતો દારુ પીતા હોવ.

કેટલાક લોકોને ઉંચું લોહીનું દબાણ રહે છે, જેનો સંબંધ ક્રિનીની સમસ્યાઓ જેવી અન્ય તથાબી સિથ તિસાથે જોડાયેલો છે.  
આ લોકો માટે,  
ત્યાબી સમસ્યાઓની સારવાર કરવાથી લોહીનું દબાણ ઘટીને રાખેતા મુજબ થઈ શકે.

## તમારું લોહીનું દબાણ નીચું લાવવા માટેની સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી

- ▶ તમારું લોહીનું દબાણ ખૂબ ઉંચું હોય, તો તમે તેને નીચું લાવવામાં મદદ કરવા તમારી જીવનશૈલીમાં સ્વાસ્થ્યપ્રદ ફેરફારો કરી શકો. તમારા ભોજન અને પ્રવૃત્તિમાં નીચેના ફેરફારો તમારા લોહીના દબાણ પર સાચી અસર ઉભી કરી શકે છે.
- 1) ઓછું મીઠું ખાવ
- ▶ અતિશય મીઠું તમારા લોહીના દબાણને વધારે છે, જેથી જેમ બને તેમ ઓછું મીઠું ખાવું અગત્યનું છે. તમે ખાવ છો, તે મોટાભાગનું મીઠું તમે તમારા આહારમાં ઉમેરો છો તે નથી, પરંતુ તે બ્રેડ નાસ્તાના સિરિયલ્સ અને તૈયાર ભોજન જેવા તૈયાર કરેલા આહારમાં હોય છે.
- ▶ રાંધો ત્યારે અથવા ટેબલ પર તમારા આહારમાં મીઠું ન ઉમેરો. આહારની ખરીદી કરો ત્યારે લેબલ તપાસો અને શક્ય હોય ત્યારે ઓછા મીઠાનો વિકલ્પ પસંદ કરો.

## 2) વધુ ફળ અને શાકભાજ ખાવ

- ▶ ફળ અને શાકભાજ ખાવાથી તમારું લોહીનું દબાણ ઓછું કરવામાં મદદ થાય છે. પુષ્ટ વ્યક્તિએ દરરોજ ફળ અને શાકભાજના ઓછામાં ઓછા પાંચ ભાગ ખાવા. એક ભાગ ૮૦ ગ્રામનો, અથવા અંદાજે તમારી મુઢીના કંદનો હોય છે.
- ▶ જુદી જુદી શ્રેષ્ઠીનાં ફળો અને શાકભાજ ખાવાના પ્રયત્નો કરવો. સૂક્કવેલા, થીજવેલાં અને ઉભામાં પેક કરેલા સારાં હોય છે, પરંતુ તેમાં મીઠું, ખાંડ કે ચરબી ઉમેરી છે કે કેમ તે તપાસવું

## તમારા લોહીના દબાણને અસર કરી શકતી બીજી કેટલીક વસ્તુઓ

- ▶ વય :—  
તમારી ઉંમર વધતી જાય તેમ બિન-સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીની અસરો ઊભી થાય અને તમારું લોહીનું દબાણ વધી શકે.
- ▶ વંશીય મૂળ :—  
આફિકન-કેરેબિયન તથા દક્ષિણ એશિયન સમુદ્રાયોના લોકોને અન્ય લોકો કરતાં ઉંચા લોહીના દબાણનું વધુ જોખમ હોય છે.
- ▶ કૌટુંબિક ઇતિહાસ :—  
તમારા કુટુંબના બીજા સભ્યોને ઉંચું લોહીનું દબાણ હોય, અથવા હતું તો તમને વધુ જોખમ રહે છે.

### 3) ઓછો દારુ પીવો

- ▶ તમે વધુ પડતો દારુ પીવો તો તમારું લોહીનું દબાણ સમય જતાં વધશે. હાલની ભલામણ કરેલ મર્યાદા, પુરખો માટે અઠવાડિક ૨૧ દારુના યુનિય અને સ્ત્રીઓ માટે અઠવાડિક ૧૪ દારુના યુનિટ છે. એક યુનિટ એટલે અંદાજે બિયર કે સિડરનો અડધો પિન્ટ, દારુની નાની ઘાલી અથવા સિપરિટ્સ માટે એક પબનું માપ.
- ▶ તમે ભલામણ કરાયેલ દારુની મર્યાદા સ્વીકારો તો તમારું લોહીનું દબાણ નીચું લાવવામાં મદદ થશે.

### 4) આરોગ્યપ્રદ વજન રાખવું

- ▶ તમારે જરૂર પડે તો, વજન ઘટાડવાથી તમારું લોહીનું દબાણ ઘટાડવામાં મદદ થશે અને તમારી આરોગ્ય સમસ્યાઓનું જોખમ ઘટશે. વજન ઘટાડવાનો ઉત્તમ રસ્તો ઓછા ફિટની અને ઓછી કેલરીનો ખોરાક પસંદ કરવો અને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી તે છે. તમે ડાયટ પર ગયા વિના આ કરી શકો છો.
- ▶ તમારી જાતે વાસ્તવિક ઉદ્દેશો નક્કી કરો. તમારા ભોજન અને પ્રવૃત્તિમાં તમે જિંદગી માટે ચાલુ રાખી શકો તેવા નાના ફેરફારો કરો.

### 5) વધુ સક્રિય થવું

- ▶ અઠવાડિયામાં પાંચ વખત ૩૦ મિનિટ મધ્યમસરની કસરત તમારા હૃદયને તંદુરસ્ત રાખી શકે છે, અને તમારું લોહીનું દબાણ ઘટાડી શકે છે. તમને દિવસમાં ૩૦ મિનિટ ન મળી શકે તો, નાના પ્રમાણમાં તમારી પ્રવૃત્તિ વધારવાથી પણ મદદ થઈ શકે.
- ▶ તમારી રોજિંદી જિંદગીમાં તમે વધુ કેવી રીતે સક્રિય બની શકો તે વિચારો. કોઈપણ પ્રવૃત્તિથી તમને હુંઝાશ અનુભવાય અને થોડોક શ્વાસ ચઢે તો તે આદર્શ છે.

### ગુંચા લોહીના દબાણ માટેની દવાઓ

- ▶ તમારા ભોજનમાં ફેરફાર અને વધુ સક્રિય થવાથી તમને તમારું લોહીનું દબાણ કાબૂમાં લેવામાં ખરેખર મદદ થશે, પરંતુ તેનાથી તે પૂરતા પ્રમાણમાં નીચું થશે નહીં. તેને વધુ નીચું લાવવા તમારે દવાઓ લેવી જરૂરી બની શકે.
- ▶ ગુંચા લોહીના દબાણ માટે દવાઓની વિશાળ શ્રેણી છે. આમાંની મોટાભાગની દવાના ચાર મુખ્ય પ્રકારો નીચે વર્ગીકૃત કરી છે:
  - ▶ ACE ઇન્હિબિટર્સ
  - ▶ એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર્સ
  - ▶ કેલિશયમ ચેનલ બ્લોકર્સ
  - ▶ થાઈઆઇડ ડાયયુરોટિક્સ
 બીજા પ્રકારની દવાઓ મળે છે, પરંતુ આ ચાર પ્રકારની દવાઓ આજે સામાન્ય રીતે ખૂબ વપરાય છે.

ડોક્ટરો પાસે શાનો ઉપયોગ કરવો તે નક્કી કરવામાં મદદ કરવા માર્ગદર્શક સૂચનાઓ હોય છે, પરંતુ તમારા માટે સાચી દવા શોધવામાં સમય લાગી શકે.

### તમારા માટે સાચી દવાઓ શોધવી

- ▶ દરેક બ્યકિટ અલગ છે, અને કેટલાક પ્રકારની દવાઓ જુદા જુદા પ્રકારના લોકોમાં વધુ સારું કામ કરે છે. જે મિત કે સંબંધી માટે સારું કામ આપે, તે તમારા માટે એટલી સારી કારગત ન પણ નિવાડે.
- ▶ ધણાં લોકોને લાગે છે કે એક દવાથી તેમનું લોહીનું દબાણ પૂરતા પ્રમાણમાં નીચું ઉત્તરશે નહીં. દરેક પ્રકારની દવા, શરીરની જુદી જુદી સિસ્ટમને અસર કરે છે, તેથી એક કરતા વધુ દવા લેવાથી તમારા લોહીના દબાણમાં પર વધુ અસર થઈ શકે છે.

## તમારી દવાઓ પાસેથી સૌથી વધુ લાભ મેળવવો

- ગુંબું લોહીનું દ્વારા મટી શકૃતું નથી અને તમારે દવાઓ લેવાની જરૂર પડે તો, તે કદાચ જિંદગીભર લેવી પડશે. તમે બંધ કરશો તો, તમારું લોહી દ્વારા ફરીથી વધી જશે.
- તમને સારું લાગતું હોય તો પણ તમારી દવાઓ લેવાનું ચાલું રાખતું અત્યંત અગત્યાનું છે. તમારા લોહીના દ્વારાને નીંયું રાખીને, તમે તમારા હૃદય અને રક્તવાહિનીને નુકસાન અને રોગ સામે રક્ષણ આપો છો.

## તમારા ડોક્ટર કે નર્સ સાથે કામ કરવું

- તમે નવી દવા શરૂ કરો પછી તમારા ડોક્ટર કે નર્સ પ્રમાણમાં તરત તમને ફરી જોવા માગશે. આ તમને તે કેટલી સારી અસર કરે છે તેની ખાતરી કરવા માટે અને તમને કોઈ આડ-અસરો થઈ નથી તેની ખાતરી કરવા છે.
- તમને નવી દવા શરૂ કરો પછી તમને જુદી લાગણી થવાની શરૂઆત થાય તો, તેની સાથે આવતી પત્રિકા પરની આડ-અસરોની યાદી તમે ચકાસી શકો. પરંતુ તમારા ડોક્ટર કે નર્સ કે તમારા ફાર્માસિસ્ટ સાથે વાત કરવી વધુ ઉપયોગી થશે. તેઓ દવાઓમાં નિષ્ણાત હોય છે અને તમને સલાહ આપી શકશે.
- તમને દવાથી આડ-અસરો થાય તો, તમારા ડોક્ટર કે નર્સ તમારા ડોઝમાં ફેરફાર કરી શકે, અથવા જુદી દવા અજમાવી શકે જે તમારા માટે વધુ કારગત બની શકે.

તમારી રોજિંટી જિંદગીમાં તમારી દવાઓને સામેલ કરો - તે દરરોજ એક સરખા સમયે લો, અને તે લેવાની ટેવ પાડો. તેનાથી દવાનો સૌથી વધુ લાભ મેળવવામાં તમને મદદ થશે.

## ઘરમાં તમારું લોહીનું દ્વારા માપવું

- તમારા ડોક્ટર કે નર્સની એપોઈન્ફેન્ટની વચ્ચે તમે ઘરમાં તમારું પોતાનું લોહીનું દ્વારા માપો તો તે તમને વધુ મદદરૂપ જરૂરાશે. તમારી રોજિંટી જિંદગીમાં લોહીનું દ્વારા કેવું અને શું છે તે જોવા માટે આ ખરેખર ઉપયોગી માર્ગ બની શકે છે.
- તમારા ડોક્ટર કે નર્સને, ઘરે તમારું લોહીનું દ્વારા માપવા અંગે વાત કરો. તમે દવાખાનામાંથી બહાર હોવ ત્યારે તમારું લોહીનું દ્વારા કેવું રહે છે તે જાણવામાં તેમને રસ પડશે.

### લોહીના દ્વારાના મોનિટર્સ

- તમે ઘરમાં તમારું લોહીનું દ્વારા માપવાનું વિચારતાં હોવ તો, યોગ્ય મોનિટર પસંદ કરવું અગત્યાનું છે. તમારા હાથના ઉપલા ભાગમાં માપ લેતાં મોનિટરો વધુ ચોક્કસ અને સુસંગત હોય છે.
- તમે જે કોઈ મોનિટર પસંદ કરો તેમાં ખાતરી કરો કે તે ચિકિત્સકીય રીતે કાયદેસર માન્ય હોય. આનો અર્થ એ કે તેનું પરીક્ષણ કરાયું છે અને તે જે પરિણામો આપે તેના પર તમે વિશ્વાસ રાખી શકો છો.


### તમારું લોહીનું દ્વારા કયારે અને કેવી રીતે માપવું

- તમારું લોહીનું દ્વારા કેટલીવાર માપવું તે અંગે સલાહ લેવા. તમારા ડોક્ટર કે નર્સને પૂછો. શરૂઆતમાં નિયમિત તપાસ કરવી એ સારો વિચાર છે, પરંતુ ત્યારબાદ તમે તે ધીમે ધીમે ઓઠાયું કરી શકો.
- તમારું શરીર હળવું હોય ત્યારે, દિવસના તે જ સમયે, લોહીનું દ્વારા માપવાનો પ્રયત્ન કરવો. એવી ખાતરી કરવાનો પ્રયત્ન કરવો કે તમે જેવા સાથે જેવાની સરખામણી કરો છો.
- ઘરમાં માપવાનું કામ દરેક માટે નથી. તેનાથી તમારા લોહીના દ્વારા અંગે તમે વધુ વિંતાતુર બન્યા છો એમ લાગે તો તમારા ડોક્ટર કે નર્સ સાથે વાત કરવી.

## મને કોઈ ઘ્યાલ ન હતો: ટોમની વાર્તા

તે રહેતા મુજબની લોહીના દ્બાષની તપાસ હતી. અમે લોહીના દ્બાષ જગરૂકતા પ્રસંગનું સંચાલન કરવાના હતા અને પ્રથમ મને મારું લોહીનું દ્બાષ તપાસવા જણાવવામાં આવ્યું હતું.

મેં મારું લોહીનું દ્બાષ ચકાસાવડાવ્યું ત્યારે, આરોગ્ય સલાહકારો મારી સામે આધાત અને ચિંતાતુર નજરે જોયું. તેણીએ જણાવ્યું મને લાગે છે તમારે તમારા ચિકિત્સકોને મળવું જોઈએ - હમણાં જ.



તે ક્ષણથી અત્યારસુધી મને કશું ખોટું હોવાનું કોઈ ચિહ્ન જણાવ્યું ન હતું. હું દર વર્ષનો હતો. મને સારું લાગે છે અને હું ૩૦ વર્ષનો જીવાન હતો ત્યારે હું જે વસ્તુઓ કરતો તે કરવાનો પ્રયત્ન કરતો હતો. બરાબર છે, મારું વજન હોવું જોઈએ તે કરતા થોડું વધારે હતું પરંતુ એ તો કોની સાથે નથી થતું?

મે કહ્યું, પરંતુ મને કશું લાગતું નથી.  
હા, તેણીએ સમજાવ્યું, તેથી જ તેને શાંત હત્યારો કહેવામાં આવે છે.

## આ પુસ્તિકા અંગે

તમને હીચું લોહીનું દ્બાષ હોય તો આ પુસ્તિકા તમારા માટે છે. તે લોહીના દ્બાષ અંગેની મૂળભૂત માહિતી, અને ઊંચા લોહીના દ્બાષ સાથે કેવી રીતે જીવનું તે અંગેની માહિતી તમને આપવા માટે લખવામાં આવી છે. તે નીચેની બાબતો અંગે વાત કરે છે:

ઊંચા લોહીના દ્બાષનો ખરેખર અર્થ શું છે  
હીચું લોહીનું દ્બાષ કોને થાય છે અને કયા કારણથી  
લોહીનું દ્બાષ નીચું લાવવા જીવનશૈલીમાં ફેરફારો  
ઊંચા લોહીના દ્બાષ માટે દવાઓ

આ પુસ્તિકા, જેઓને હીચું લોહીનું દ્બાષ છે તે લોકો અને આ ક્ષેત્રમાં નિષ્ણાત વ્યાવસાયિકોની મદદથી લખવામાં આવી છે. પોતાના માટે સાચી પસંદગી કરવા તમને જરૂરી માહિતી આપવા આ પુસ્તિકા તૈયાર કરાઈ છે.

## બ્લડ પ્રેશર એસોસિએશન (Blood Pressure Association) અંગે

- બ્લડ પ્રેશર એસોસિએશન એ યુ.કે. ની ચેરિટી છે, જે સ્ટ્રોક, દ્વારા હુમલો અને હૃદયરોગથી થતી અશક્તતા કે કાચી ઊભરણ મૂયુને અટકાવવા રાખ્યાં લોહીના દ્બાષનું પ્રમાણ નીચું લાવવા કામ કરે છે. સામાન્ય લોકો, જોખમ હોય તેવા લોકો તથા આરોગ્ય વ્યાવસાયિકોમાં ઊંચા લોહીના દ્બાષની અગત્યતા અંગે જગરૂકતા ઉભી કરીને અમે આ કરીએ છીએ. આ રિસ્ટિ સાથે જીવતાં અને તે વધવાનું જોખમ હોય તેવા લોકોએ અમે મદદ અને સહાય કરીએ છીએ. હીચું લોહીનું દ્બાષ ધરાવતાં લોકો બને તેટલી ઉત્તમ સંભાળ મેળવે તે સુનિશ્ચિત કરવા અમે તેઓને આ ગુંબેશ મારફત અવાજ આપીએ છીએ.
- લોહીના દ્બાષ એસોસિએશન એક નોંધાયેલી ચેરિટી છે અને અમારું કામ હાથ ધરવામાં મદદ થાય તે માટે અમે સખાવત પર આધાર રાખીએ છીએ. આ પુસ્તિકા તૈયાર કરવાના ખર્ચ પેટે તમે આપી શકો તે કોઈપણ સખાવત માટે અમે તમારા આભારી રહીશું.